

MOMના મોડર્ન અવતાર



માતાઓ સંતાનના માર્ગમાં આવતા તમામ અંતરાયો દૂર કરે છે. બાળક સુરક્ષિત અને સલામત રહે એવી ઈચ્છા રાખવી તેમાં કંઈ ખોટું નથી પરંતુ એક સ્નોપ્લાઉ મોમ તેના બાળકને કોઈ પણ પ્રકારની અગવડ કે નિરાશાનો અનુભવ કરવા દેતી નથી જે બાળકના વિકાસ અને સ્વતંત્રતાને રૂંધે છે.

જાનવરોના રૂપમાં માતાઓના પ્રકાર
તમને આશ્ચર્ય થશે પણ મમ્મીઓ જાનવરોને નામે પણ ઓળખાય છે.

સમયના પરિવર્તન સાથે મમ્મીઓની પરવરિશની રીત પણ અનોખી થઈ ગઈ છે. આજની કેટલીક અજીબોગરીબ મમ્મીના અવતાર, એમનો બાળઉછેર જોઈ ક્યારેક હસવું આવે છે તો ક્યારેક હેરાન થવાય છે. જો તમે સોશયલ મીડિયા પર એક્ટિવ હો તો તમે સિલ્કી મોમ, કન્ચી મોમ જેવા શબ્દોથી પણ પરિચિત હશો. આ ઉપરાંત તમે આપણી ટ્રેડિશનલ મમ્મીઓને પણ ઓળખતાં હશો. ‘મધર્સ-ડે’ નિમિત્તે હળવી શૈલીમાં જોઈએ માતાઓનાં અવનવાં રૂપ...

કન્ચી મોમ

કન્ચી મોમ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સામાજિક રીતે જાગૃત હોય છે. આ માતા સુપર કોન્શિયસ હોય છે. કદી મેકઅપ કરતી નથી, મોટા ભાગે શાકાહારી હોય છે. આ પ્રકારની મોમ કાપડના ડાયપરનો ઉપયોગ કરે છે, એક વર્ષ બાદ પણ સ્તનપાન કરાવે છે, તેઓ પ્લાસ્ટિક મુક્ત રમકડાં અને ઓર્ગેનિક ફૂડ ખરીદે છે અને કોઈ પણ કિંમતે સ્કિન ટાઈમ ટાળે છે. તેઓ બાળકને રસી અપાવતી નથી, મોડર્ન મેડિસિન્સ અને ટેકનોલોજીના ઉપયોગને ટાળે છે. તેઓ હોમ સ્કૂલિંગને વધુ પસંદ કરે છે.

સિલ્કી મોમ

સિલ્કી મોમ્સ કન્ચી મોમ્સથી વિપરીત છે. આ પ્રકારની માતા વધુ આધુનિક, વ્યવહારુ અભિગમ અપનાવે છે. સિલ્કી મોમ એક આધુનિક મા હોય છે જે બાળઉછેરમાં વિજ્ઞાન, ચિકિત્સા અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ સ્તનપાન કરાવે છે પરંતુ એને બોટલથી દૂધ પીવડાવવામાં પણ વાંધો નથી. એ ચોક્કસ જ ડિસ્પોઝેબલ ડાયપરનો ઉપયોગ કરે છે. (કોની પાસે બાળોતિયા- ડાયપર ધોવાનો ટાઈમ છે?) સિલ્કી મોમને એના સંતાન શુગર, સ્કિનનો ઉપયોગ કરે કે શોપમાંથી લાવેલાં રમકડાંથી રમે તેમાં વાંધો નથી. એ ક્યારેક બાળકને ફાસ્ટફૂડ ખાવાની છૂટ પણ આપે છે. તેને મેડિસિન અને રસીઓમાં વિશ્વાસ હોય છે. એ બાળકને બેડ પર સાથે સૂવડાવવાને બદલે પારણામાં સૂવડાવવાનું પસંદ કરે છે.

સ્કન્ચી મોમ

સ્કન્ચી મોમ સિલ્કી અને કન્ચીનું મિશ્રણ છે. તેઓ સ્તનપાન કરાવે છે અને ઓર્ગેનિક ફૂડ પસંદ કરે છે પરંતુ એ ડિસ્પોઝેબલ ડાયપર અને સ્ટ્રોલરનો ઉપયોગ પણ કરે છે. એ કદાચ બોટલથી દૂધ પીવડાવે પરંતુ સ્કિન ટાઈમથી દૂર રહેવાની કોશિશ કરે છે.

ટ્રેડિશનલ મોમ



ન્યૂ એજની મોમ માટેની ટર્મ્સ પહેલાં આપણે સામાન્ય રીતે અન્ય પ્રકારની માતાઓને ઓળખતાં હતાં. તેઓ હજુ પણ છે જ અને શક્ય છે કે તમે એનાથી સારી રીતે પરિચિત હો.

હેલિકોપ્ટર મોમ

આ એવી માતા છે જે તેના સંતાનના જીવનમાં એટલી હદ સુધી સામેલ હોય છે કે તે સતત એની આસપાસ હેલિકોપ્ટરની જેમ મંડરાતી રહે છે. એ બાળક પર જરૂરત કરતાં વધારે નજર રાખે છે, લાડપ્યાર કરે છે. બાળક ક્યાં ગયું? શું કરે છે? કોની સાથે વાત કરે છે? દરેક જગ્યાએ એની સિક્યુરિટી કેમેરા જેવી નજર રહે છે. સ્કૂલ, પાર્ક, ટ્યુશન- બધી જગ્યાએ સાથે જવા માટે તૈયાર.

ઈન્સ્ટા મોમ

બાળકે પ્રથમ ડાગલું ભર્યું? પહેલાં વીડિયો બનાવો. હોમવર્ક પૂરું કર્યું? ઈન્સ્ટા સ્ટોરી અપડેટ કરો. એમની પરવરિશનો 50% ભાગ ફોટોશૂટ અને 50% સોશયલ મીડિયા લાઈફસ્ટાઈલ હોય છે.

ટિકટોક/ રીલ્સ મોમ

જ્યારે પણ જુઓ, કોઈ નવા ટ્રેન્ડ પર રીલ બનાવતાં નજરે પડશે. બેટા, મારો વીડિયો શૂટ કરી આપ ને!



જીમ ફીક મોમ

બાળક પડી ગયું? કંઈ નહિ. મજબૂત બનો. રમવા જવું છે? પહેલાં 20 મિનિટ વોર્મઅપ. સંતાનોથી વધારે એ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે અને બાળક પણ બોડી બિલ્ડર બને એવી અપેક્ષા રાખે છે.

ફી રેન્જ મોમ

ફી રેન્જ મોમ હેલિકોપ્ટર મોમથી તદ્દન વિપરીત હોય છે. આ પ્રકારની માતા સંતાનને વધારે આઝાદી આપે છે. એ બાળકને સ્કૂલ કે કોઈની પણ દેખરેખ વગર બહાર રમવા જવા દે છે. સૂવાનાસમય જેવા ચોક્કસ નિયમો કે રૂટિનની વાત હોય તો એમાં એ જરૂર મુજબ છૂટછાટ આપે છે. અલબત્ત, આ પ્રકારની પેરન્ટિંગ સ્ટાઈલ વર્ષોથી વિવાદમાં રહી છે. જ્યારે તેના સમર્થકોનું માનવું છે કે એ રચનાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને સંતાનનો આત્મવિશ્વાસ વધારે છે.

ગૂગલ ગુરુ મમ્મી

બાળકને શરદી-ઉધરસ થયાં નથી કે છીંક આવવી નથી- તરત ગૂગલ પર સર્ચ. છીંક આવવી શુભ કે અશુભ? એમને માટે ડોક્ટર કરતાં વધારે ભરોસાપાત્ર ગૂગલ બાબા અને મોમ્સ ગ્રુપ હોય છે.

સ્નોપ્લાઉ મોમ

સ્નોપ્લાઉ મોમ (જેને લોનમોવર નામથી પણ ઓળખવામાં આવે છે) હેલિકોપ્ટર પેરન્ટસ જેવી જ છે. એ તેના સંતાન પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરે છે, એની સાથે વધારે જોડાયેલી રહે છે પરંતુ વધુ અગત્યનું એ છે કે એ વધુ પડતી રક્ષણાત્મક છે. જે રીતે સ્નોપ્લાઉ રસ્તા પરનો સ્નો સાફ કરે છે આ પ્રકારની

ડોલ્ફિન મોમ

એક બાજુ ટાઈગર મોમ છે અને બીજી બાજુ એલિફન્ટ મોમ છે તો ડોલ્ફિન મોમ ક્યાંક વચ્ચે છે. આ સ્ટાઈલ પેરેન્ટિંગની ફર્મ છતાં ફ્લેક્સિબલ પધ્ધતિ વર્ણવે છે. આ પ્રકારની મમ્મીઓ શૈક્ષણિક સફળતા માટે દબાણ કરી શકે છે પરંતુ સાથે જ ઘણો બધો પ્રેમ અને સપોર્ટ પણ આપે છે.

ટાઈગર મોમ

ઓહ! ટાઈગર મોમ? જ્યારે શિક્ષણ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓની વાત હોય ત્યારે આ પ્રકારની માતા બહુ કડક હોય છે. તે એશિયન પેરેન્ટિંગ સ્ટાઈલ સાથે મજબૂત રીતે સંકળાયેલી છે. તે ઈચ્છે છે કે તેનાં બાળકો સફળ થાય અને તે તેમને તે ધ્યેય તરફ આગળ ધકેલે છે.



એલિફન્ટ મોમ

બીજી બાજુ એલિફન્ટ મોમ ખૂબ જ સંભાળ રાખનારી અને પ્રેમાળ હોય છે. એ શિક્ષણ અને સફળતા કરતાં ભાવનાત્મક લગાવ અને સલામતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ટાઈગર મોમ કડક

અને માંગ કરનારી હોય છે જ્યારે એલિફન્ટ મોમ સમજુ અને કમ્ફર્ટ આપનારી હોય છે. આ તો આપણે માતાઓના કેટલાક પ્રકાર જોયા. આ ઉપરાંત તમે અન્ય ઘણી માતાઓના સંપર્કમાં આવ્યા હશો પરંતુ અહીં આપેલી માતાઓમાંથી તમે કયા પ્રકારમાં આવો છો?

